



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૨/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૪૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૧ કેસ કરી, ૬૧ વ્યક્તિઓને ઝડપી, ૨૫૩ લીટર દેશી દારૂ, ૫૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૪૦ બિયર ટીન, ૨ સ્ફટર અને ૧ પીક અપ ડાલુ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૧,૮૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૪૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૩૫૦/૧૯

આનંદનગર: જગદીશભાઈ અનંતરાય ગુપ્તા (રહે. શ્યામ હીલ જી.એસ.ટી.કોસીંગ પાસે ન્યુ રાણીપ) એ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૨/૧૯ રાતના ૯/૦૦ થી તા.૨૨/૨/૧૯ સવારના ૯/૦૦ વાગ્યા દરમિયાન આનંદનગર રીવેરા આર્કેડ ખાતે દુકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તેમજ સાહેદની દુકાનમાંથી રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૬૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.આર.ચૌહાણ ચલાવે છે.

સાબરમતી: અશ્વિનકુમાર પ્રહલાદભાઈ પટેલ (રહે.વલ્લભપાર્ક ટેનામેન્ટ ડીકેબીન સાબરમતી) એ તા.૨૨/૨/૧૯ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૦૨/૧૯ રાતના ૯/૦૦ થી તા.૧૦/૦૨/૧૯ સવારના ૯/૦૦ વાગ્યા દરમિયાન પોતાના પાર્લરના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ પાર્લરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૮૨,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.ટી.દેસાઈ ચલાવે છે.

ચાંદખેડા: જાધોરામ ધુકાજી ચૌધરી (રહે.મુખીવાસ મોટેરાગામ મોટેરા) એ તા.૨૨/૨/૧૯ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૦૨/૧૯ રાતના ૯/૩૦ થી તા.૧૪/૨/૧૯ સવારના ૭/૦૦ વાગ્યા દરમિયાન મોટેરા સ્ટેડીયમ રોડ ઉપર આવેલ ઉર્જા કોમ્પલેક્ષ દુકાન નં-૬,૭ સૌરાષ્ટ્ર ગંઠીયા રથ નામની દુકાનના શટરનું તાળુ તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર કિમત રૂપિયા ૧૦,૦૦૦/- અને રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૫૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.આર.દેસાઈ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૩૫૧/૧૯

વસ્ત્રાપુર: વિકાસચંદ્ર જગદિશચંદ્ર વ્હોરા (ઉ.વ.૬૬) (રહે. સતેજ એપાર્ટમેન્ટ કેમ્બ હોટેલ સામે, ગુલાબટાવર રોડ, થલતેજ) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૨/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે માનસી સર્કલ ખાતે પ્રિન્સ પાંઉભાજી પાસે આવેલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા બેંકમાંથી નજર ચુકવી અજાણી વ્યક્તિ બેગની ચોરી કરી લઈ ગઈ હતી. બેગમાં રોકડ રૂપિયા ૧,૮૫,૦૦૦/- હતા. આ ગુનાની તપાસ હે.કો.શ્રી દેવેન્દ્રસિંહ ઈન્દ્રસિંહ ચલાવે છે.

ચાંદખેડા: વિશાલ ભુપતભાઈ સોલંકી (ઉ.વ.૨૮) (રહે.શ્રી બાલાજી વિલા સોસાયટી વિભાગ-૨ ચાંદખેડા) એ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૨/૧૯ રાતના ૮/૦૦ થી ૯/૩૦ વાગ્યા દરમિયાન ચાંદખેડા ફોર ડી સ્કવેર મોલ ગાલીયા સ્વીટ સામે પાર્ક કરેલ પોતાની કારના દરવાજાનો કાચ તોડી કારમાંથી બે સ્ક્રૂલ બેગ તથા થેલો અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ હતી. થેલામાં લેપટોપ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- તેમજ બેગમાં જરૂરી કાગળો તેમજ રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જી.વી.ચૌધરી ચલાવે છે.

ટ્રેઈનની અડફેટે મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૫૨/૧૯

ખોખરા: ભરતકુમાર મુલચંદ પિન્યા (ઉ.વ.૫૮) (રહે. સત્વા શક્તિ એપાર્ટમેન્ટ અપ્સરા આરાધના સિનેમા સામે કાંકરીયા મણીનગર) તા.૨૧/૨/૧૯ રાતના ૧૦/૧૫ વાગ્યાના સુમારે રેલ્વે અપ લાઇન પોલ ન-૪૯૨/૧૫ થી ૪૯૨/૧૭ વચ્ચે અપ લાઇન ઉપર ટ્રેઈનની અડફેટે આવી જતા ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી બી.કે.વાઘેલા ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૫૩/૧૯

જીઆઈડીસી વટવા: ઈલીયાઝ સ/ઓ બશીરા મુસ્લીમ (ઉ.વ.૨૭) (મુળ વતન સફીપુરા પટા તાલુકો-બુકાના બાગર જી-મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશ) તા.૨૨/૨/૧૯ બપોરના ૨/૨૦ વાગ્યાના સુમારે આઇસર ગાડીમાં સાણંદ ખાતેથી પુનીત રોડ વેઝ પ્રા.લી.ની ઈલે પેનલો જીઆઈડીસી વટવા વિનોબાભાવેનગર ખાતે લઈને આવ્યા હતા ત્યારે ઈલે પેનેલ નીચે પડી જતા પેનલ દોરડા વડે મજબુત બાંધવા જતા નીચે પડતા ઈલીયાઝ પેનલ નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એસ.ગોસ્વામી ચલાવે છે.

નિકોલ: દિનેશ સ/ઓ કૈલાશભાઈ મેઘવાલ (ઉ.વ.૨૫) (રહે. બળીયાદેવ ટેકરો રામાપીર મંદિર સામે મારવાડી વાસ નિકોલ) એ અગમ્ય કારણસર તા.૨૨/૨/૧૯ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી લક્ષ્મણભાઈ લુંજાભાઈ ચલાવે છે.

જીઆઈડીસી વટવા: સુખમાયા વા/ઓ ગજમન ગાલે (ઉ.વ.૪૧) (રહે. નવી વસાહત જસોદાનગર) એ બિમારીથી કંટાળી તા.૨૨/૨/૧૯ નારોજ પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ જસોદાનગર ચોકી ઈન્ચાર્જ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.